

Seat No. / Enrolment No.:

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
Diploma Engineering – SEMESTER – 1 (OLD) – EXAMINATION – Summer-2024

Subject Code: 3300001

Date: 06-06-2024

Subject Name: Basic Mathematics

Time: 10:30 AM TO 01:00 PM

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of non-programmable scientific calculator is permitted.
6. English version is authentic.

Q-1 Fill in the blanks using appropriate choice from the given options.

(14)

(1) If $\log_7 x = 1$ then $x = \underline{\hspace{2cm}}$

- (a) 1 (b) 0 (c) 7 (d) -7

(1) $\log_7 x = 1 \Rightarrow x = \underline{\hspace{2cm}}$

- (a) 1 (b) 0 (c) 7 (d) -7

(2) $\log_5(125) = \underline{\hspace{2cm}}$

- (a) 5 (b) 3 (c) 2 (d) -25

(2) $\log_5(125) = \underline{\hspace{2cm}}$

- (a) 5 (b) 3 (c) 2 (d) -25

(3) $a^{\log_a b} = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) a (c) b (d) 1

(3) $a^{\log_a b} = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) a (c) b (d) 1

(4) $\begin{vmatrix} \log_6 3 & -1 \\ \log_6 2 & 1 \end{vmatrix} = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) -1 (c) 1 (d) 2

(4) $\begin{vmatrix} \log_6 3 & -1 \\ \log_6 2 & 1 \end{vmatrix} = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) -1 (c) 1 (d) 2

(5) If $A = \begin{bmatrix} d & b \\ c & d \end{bmatrix}$ then $\text{adj } A = \underline{\hspace{2cm}}$

- (a) $\begin{bmatrix} a & -b \\ -c & d \end{bmatrix}$ (b) $\begin{bmatrix} a & c \\ b & d \end{bmatrix}$ (c) $\begin{bmatrix} d & -b \\ -c & d \end{bmatrix}$ (d) $\begin{bmatrix} -a & c \\ b & -d \end{bmatrix}$

(5) If $A = \begin{bmatrix} d & b \\ c & d \end{bmatrix}$ then $\text{adj } A = \underline{\hspace{2cm}}$

- (a) $\begin{bmatrix} a & -b \\ -c & d \end{bmatrix}$ (b) $\begin{bmatrix} a & c \\ b & d \end{bmatrix}$ (c) $\begin{bmatrix} d & -b \\ -c & d \end{bmatrix}$ (d) $\begin{bmatrix} -a & c \\ b & -d \end{bmatrix}$

(6) If $\begin{bmatrix} 0 & x & -2 \end{bmatrix} \begin{bmatrix} 1 \\ 2 \\ 3 \end{bmatrix} = [4]$ then $x = \underline{\hspace{2cm}}$

- (a) 2 (b) 4 (c) 5 (d) 6

(6) યોગ્ય [0 x -2] $\begin{bmatrix} 1 \\ 2 \\ 3 \end{bmatrix}$ = [4] એન્ડ x = _____

- (a) 2 (b) 4 (c) 5 (d) 6

(7) ઓર્ડર ઓફ મેટ્રિક $\begin{bmatrix} 2 & 1 & 5 \\ 6 & 0 & 1 \end{bmatrix}$ ઇસ = _____

- (a) 3×3 (b) 3×2 (c) 2×3 (d) નોંધે કોઈ વિષાણુ

(7) શૈખાલીક $\begin{bmatrix} 2 & 1 & 5 \\ 6 & 0 & 1 \end{bmatrix}$ ની ક્રમાંક _____ હો.

- (a) 3×3 (b) 3×2 (c) 2×3 (d) નોંધે કોઈ વિષાણુ

(8) $\tan^{-1} x + \cot^{-1} x =$ _____

- (a) 1 (b) 0 (c) $\frac{\pi}{2}$ (d) $\frac{\pi}{6}$

(8) $\tan^{-1} x + \cot^{-1} x =$ _____

- (a) 1 (b) 0 (c) $\frac{\pi}{2}$ (d) $\frac{\pi}{6}$

(9) પ્રદૂષણ અનુભવનીય $\sin(2x + 3)$ ઇસ = _____

- (a) π (b) $-\pi$ (c) 4π (d) $\frac{\pi}{2}$

(9) $\sin(2x + 3)$ નું અનુભવનીય _____ હો.

- (a) π (b) $-\pi$ (c) 4π (d) $\frac{\pi}{2}$

(10) $\sin(135^\circ) =$ _____

- (a) $\frac{1}{\sqrt{2}}$ (b) $\frac{1}{\sqrt{2}}$ (c) $\sqrt{2}$ (d) $-\sqrt{2}$

(10) $\sin(135^\circ) =$ _____

- (a) $\frac{1}{\sqrt{2}}$ (b) $\frac{1}{\sqrt{2}}$ (c) $\sqrt{2}$ (d) $-\sqrt{2}$

(11) $\frac{4\pi}{9}$ રેડિયન = _____

- (a) 40° (b) 80° (c) 20° (d) 10°

(11) $\frac{4\pi}{9}$ રેડિયન = _____

- (a) 40° (b) 80° (c) 20° (d) 10°

(12) વૉલ્યુમ ઓફ સ્પેર્ફ રેડિયન ઇસ = _____

- (a) $2\pi r^3$ (b) $\frac{4}{3}\pi r^3$ (c) $4\pi r^2$ (d) $\frac{2}{3}\pi r^3$

(12) 'r' નું વૉલ્યુમ એન્ડ એન્ફળ નું એન્ફળ ઇસ = _____ હો.

- (a) $2\pi r^3$ (b) $\frac{4}{3}\pi r^3$ (c) $4\pi r^2$ (d) $\frac{2}{3}\pi r^3$

(13) એફ પેરિમેટર ઓફ સ્ક્વાર ઇસ 40 cm, તેની એરી ઇસ = _____

- (a) 1600 cm^2 (b) 20 cm^2 (c) 10 cm^2 (d) 100 cm^2

(13) જો ચ્યાર્સ ની પ્રેરિમેટર 40 સેમી છે તો એરી ઇસ = _____ હો.

- (a) 1600 cm^2 (b) 20 cm^2 (c) 10 cm^2 (d) 100 cm^2

(14) ફોર્મુલા ઓફ ક્રીલ્ડ સ્પેર્ફ એરી ઇસ = _____

- (a) $\pi r(h+r)$ (b) $2\pi rh$ (c) $2\pi r(h+r)$ (d) $\pi r^2 h$

(14) એફ નરીકાર નું એરી ઇસ = _____ હો.

- (a) $\pi r(h+r)$ (b) $2\pi rh$ (c) $2\pi r(h+r)$ (d) $\pi r^2 h$

Q-2 (A) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(6)

(1) Solve : $\log(2x + 1) + \log(3x - 1) = 0$

(2) If Curve surface area of sphere is 616sq. cm then find diameter of sphere.

(2) જો ગોલક ની વક્સપાટી નું ક્ષેત્રફળ 616 ચો. સેમી છે તો ગોલક નો વ્યાસ શોધો.

(3) For triangle ΔABC , measurement of sides $a = 8\text{cm}$, $b = 10\text{cm}$ and $c = 6\text{cm}$ then find area of triangle.

(3) ΔABC માટે, બાજુ ઓનામાપ $a = 8$ સેમી, $b = 10$ સેમી and $c = 6$ સેમી તો ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો.

(B) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(8)

(1) Prove that $\log(x + \sqrt{x^2 - 1}) + \log(x - \sqrt{x^2 - 1}) = 0$

(1) સાબ્દિત કરોકે $\log(x + \sqrt{x^2 - 1}) + \log(x - \sqrt{x^2 - 1}) = 0$

(2) If $\log\left(\frac{a+b}{2}\right) = \frac{1}{2} [\log a + \log b]$ then prove that $a = b$

(2) જો $\log\left(\frac{a+b}{2}\right) = \frac{1}{2} [\log a + \log b]$ સાબ્દિત કરોકે $a = b$

(3) How many spherical balls of radius 2cm can be made from cube of length 44 cm.

(3) 44 સેમી લંબાઈ વાળા સમધન માથી 2 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનાવી શકાય.

Q-3 (A) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(6)

(1) If $A = \begin{bmatrix} 1 & 4 \\ 3 & 2 \\ 2 & 5 \end{bmatrix}$ and $B = \begin{bmatrix} -1 & -2 \\ 0 & 5 \\ 3 & 1 \end{bmatrix}$ then find $3A - 2B$.

(1) જો $A = \begin{bmatrix} 1 & 4 \\ 3 & 2 \\ 2 & 5 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} -1 & -2 \\ 0 & 5 \\ 3 & 1 \end{bmatrix}$ તો $3A - 2B$ શોધો.

(2) If $A = \begin{bmatrix} 1 & 2 & 3 \\ 4 & 5 & 6 \end{bmatrix}$ and $B = \begin{bmatrix} 1 & 2 \\ 2 & 1 \\ 1 & 2 \end{bmatrix}$ then find AB and BA

(2) જો $A = \begin{bmatrix} 1 & 2 & 3 \\ 4 & 5 & 6 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & 2 \\ 2 & 1 \\ 1 & 2 \end{bmatrix}$ AB અને BA શોધો.

(3) If $A = \begin{bmatrix} 3 & 1 \\ -1 & 2 \end{bmatrix}$ then prove that $A^2 - 5A + 7I = 0$.

(3) જો $A = \begin{bmatrix} 3 & 1 \\ -1 & 2 \end{bmatrix}$ સાબ્દિત કરોકે $A^2 - 5A + 7I = 0$.

(B) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(8)

(1) $A = \begin{bmatrix} -1 & 2 & 3 \\ 3 & -2 & 1 \\ 0 & 1 & 1 \end{bmatrix}$ and $B = \begin{bmatrix} 1 & 2 & -1 \\ 3 & -1 & 5 \end{bmatrix}$ then find AB . If AB is possible ? Given reason.

(1) $A = \begin{bmatrix} -1 & 2 & 3 \\ 3 & -2 & 1 \\ 0 & 1 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & 2 & -1 \\ 3 & -1 & 5 \end{bmatrix}$ તો AB શોધો. જો AB શક્ય હોય તો ? કારણ આપો.

(2) If $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ 3 & 2 & 3 \\ 1 & 1 & 2 \end{bmatrix}$ then find A^{-1}

(2) જો $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ 3 & 2 & 3 \\ 1 & 1 & 2 \end{bmatrix}$ A^{-1} શોધો.

(3) Solve Equation $3x - 2y = 8$ and $5x + 4y = 6$ using matrix method.

(3) શ્રેણીક ની મદદ થી ઉકેલો : $3x - 2y = 8$ અને $5x + 4y = 6$

Q-4 (A) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(6)

$$(1) \text{Prove that } \frac{\sin(\theta-\frac{\pi}{2})}{\cos(\theta-\pi)} + \frac{\tan(\frac{\pi}{2}-\theta)}{\cot(\pi+\theta)} + \frac{\cosec(\frac{\pi}{2}+\theta)}{\sec((\pi+\theta))} = 1$$

$$(1) \text{સાંભવત કરોકે : } \frac{\sin(\theta-\frac{\pi}{2})}{\cos(\theta-\pi)} + \frac{\tan(\frac{\pi}{2}-\theta)}{\cot(\pi+\theta)} + \frac{\cosec(\frac{\pi}{2}+\theta)}{\sec((\pi+\theta))} = 1$$

$$(2) \text{Prove that } \tan 20^\circ + \tan 25^\circ + \tan 20^\circ \tan 25^\circ = 1$$

$$(2) \text{સાંભવત કરોકે: } \tan 20^\circ + \tan 25^\circ + \tan 20^\circ \tan 25^\circ = 1$$

$$(3) \text{Prove that : } \frac{\sin \theta + \sin 2\theta + \sin 4\theta + \sin 5\theta}{\cos \theta + \cos 2\theta + \cos 4\theta + \cos 5\theta} = \tan 3\theta$$

$$(3) \text{સાંભવત કરોકે : } \frac{\sin \theta + \sin 2\theta + \sin 4\theta + \sin 5\theta}{\cos \theta + \cos 2\theta + \cos 4\theta + \cos 5\theta} = \tan 3\theta$$

(B) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(8)

(1) Draw the graph of $y = \cos x$, where $0 \leq x \leq \pi$

(1) $y = \cos x$, where $0 \leq x \leq \pi$ નો આવેખ દોરો.

$$(2) \text{Prove that } \tan^{-1}\left(\frac{5}{7}\right) + \tan^{-1}\left(\frac{1}{6}\right) = \frac{\pi}{4}$$

$$(2) \text{સાંભવત કરોકે } \tan^{-1}\left(\frac{5}{7}\right) + \tan^{-1}\left(\frac{1}{6}\right) = \frac{\pi}{4}$$

$$(3) \text{Prove that } \frac{1+\sin\theta-\cos\theta}{1+\sin\theta+\cos\theta} = \tan\left(\frac{\theta}{2}\right)$$

$$(3) \text{સાંભવત કરોકે } \frac{1+\sin\theta-\cos\theta}{1+\sin\theta+\cos\theta} = \tan\left(\frac{\theta}{2}\right)$$

Q-5 (A) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(6)

(1) If $\bar{a} = (3, -1, -4)$, $\bar{b} = (-2, 4, -3)$ and $\bar{c} = (-1, 2, -5)$ then find $|\bar{a} + 2\bar{b} - \bar{c}|$

(1) જો $\bar{a} = (3, -1, -4)$, $\bar{b} = (-2, 4, -3)$ અને $\bar{c} = (-1, 2, -5)$ તો $|\bar{a} + 2\bar{b} - \bar{c}|$ શોધો..

(2) Find the unit vector perpendicular to both the vectors $\bar{a} = (3, -1, 2)$ and $\bar{b} = (2, 1, -1)$

(2) સદીશો $\bar{a} = (3, -1, 2)$ અને $\bar{b} = (2, 1, -1)$ માટે લંબ એકમ સદીશ શોધો.

(3) What value of p vectors $a = 2i + 3j - k$ and $b = pi - j + 3k$ are perpendicular.

(3) p ના ક્યાં મૂલ્ય માટે સદીશો $a = 2i + 3j - k$ અને $b = pi - j + 3k$ પરસ્પર લંબ હોય.

(B) Attempt Any Two (કોઈ પણ બે લખો)

(8)

(1) If angle between the vectors $i + j - k$ and $2i - 2j + k$ is θ , then prove that

$$\theta = \sin^{-1}\left(\sqrt{\frac{26}{27}}\right).$$

$$(1) \text{સદીશો } i + j - k \text{ અને } 2i - 2j + k \text{ નો ઘૂણો } \theta, \text{ તો સાંભવત કરોકે } \theta = \sin^{-1}\left(\sqrt{\frac{26}{27}}\right)$$

(2) Force (1,2,3) and (3,1,1) are acting on a particle and the particle moves from (0,1,-2) to (5,1,2). Find the work done.

(2) એક કણ પર અચળ બળો (1,2,3) અને (3,1,1) લાગે છે. આ બળોની અસર હેઠળકણા, બિંદુ (0,1,-2) થી બિંદુ (5,1,2) ખસે છે તો થયેલ કાર્ય શોધો.

(3) If $\bar{a} = 3i - j - 4k$, $\bar{b} = -2i + 4j - 3k$ and $\bar{c} = i + 2j - k$ then find direction cosine of $3\bar{a} - 2\bar{b} + 4\bar{c}$

(3) જો $\bar{a} = 3i - j - 4k$, $\bar{b} = -2i + 4j - 3k$ અને $\bar{c} = i + 2j - k$ તો $3\bar{a} - 2\bar{b} + 4\bar{c}$ નો દિક્કોસાઇન શોધો.